

મહિન્દ્રાએ કોવિડ કેરટેકર્સ માટે વાહનની ખરીદીને સરળ બનાવવા કસ્ટમાઇઝ ધિરાણ યોજનાઓ પ્રસ્તુત કરી

- હેલ્થકેર/ફાર્મા સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સ જેવા મોખરાના કેરટેકર્સ અને આવશ્યક સેવા પ્રદાતાઓની વિસ્તૃત રેન્જ માટે વિશેષ ધિરાણ યોજનાઓ
- વિવિધ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર રૂ. 66,500* સુધીની છે અને તમામ વાહનો પર વિશેષ ધિરાણ યોજનાઓ છે

મુંબઈ, 11 જૂન, 2020: 20.7 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે કોવિડ રોગચાળા દરમિયાન મોખરે રહીને લોકોની સારવાર કરનાર અને સાથસહકાર આપનાર કોવિડ કેરટેકર્સ અને આવશ્યક સેવા પ્રદાતાઓને સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ માટે કંપનીએ કોવિડ કેરટેકર્સ અને આવશ્યક સેવા પ્રદાતાઓને કંપનીનાં તમામ વાહનો પર અનેક વાજબી ધિરાણ યોજનાઓ ઓફર કરી છે.

ઉદ્યોગમાં સૌપ્રથમ કંપનીએ ડોક્ટરો, નર્સો, પેરામેડિક્સ, સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપરાંત પત્રકારો/મીડિયા પ્રોફેશનલ્સ, રેલવે/એરલાઇન સ્ટાફ અને અન્ય સહિત આવશ્યક સેવા પ્રદાતાઓની સંપૂર્ણ રેન્જને એની ઓફર કરી છે.

આ રોગચાળા દરમિયાન મોખરે રહેલા કોવિડ કેરટેકર્સ માટે ફાઇનાન્સ યોજનાઓ વિશે એમએન્ડએમ લિમિટેડનાં ઓટોમોટિવ ડિવિઝનનાં સીઇઓ વીજય નાકરાએ કહ્યું હતું કે, “દુનિયામાં અન્ય કોઈ પણ જગ્યાની જેમ ભારતના મોખરાના અને આવશ્યક સેવા પ્રદાતાઓએ તેમના ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરી છે અને આ પડકારજનક સમયગાળા દરમિયાન સલામતી જાળવવા સતત કામ કર્યું છે. અમે આ કસ્ટમાઇઝ ફાઇનાન્સ સ્કીમ્સ ઓફર કરીને અમારી રીતે તેમનો આભાર માનીશું, જે તેમની મહિન્દ્રાના વાહનના માલિક બનવાની પ્રક્રિયાને સરળ બનાવશે.”

શ્રી નાકરાએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમને મોખરે રહેલા તમામ કેરટેકર્સ અને હેલ્થકેર/ફાર્મા સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, મીડિયા, સરકારી કર્મચારીઓ અને મેડિસિન/વેજીટેબલ/મિલ્ક સપ્લાયર્સ જેવા આવશ્યક સેવા પ્રદાતાઓને વિશેષ ઓફરો કરવાની ખુશી છે.”

કોવિડ કેરટેકર્સ માટે સંપૂર્ણ લાભ રૂ. 66,500 જેટલો થાય છે. મહિન્દ્રા વિવિધ ફાઇનાન્સ સ્કીમ્સ ઓફર કરવા વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે કામ કરીને કોવિડ કેરટેકર્સને સક્ષમ બનાવે છે**. એમાંથી થોડી નીચે મુજબ છે :

- અત્યારે ખરીદી કરો અને વર્ષ 2021માં ચુકવણી કરો
- 8 વર્ષ સુધી ફંડિંગ
- 100 ટકા સુધી ઓનરોડ ફંડિંગ
- 90 દિવસ મોરેટોરિયમ
- **BS IV** પિક અપને સમકક્ષ ઇએમઆઈની ચુકવણી કરીને **BS VI** પિક અપના માલિક બનો
- ડોક્ટરો માટે 50 ટકા પ્રોસેસિંગ ફીની માફી

આ યોજનાઓ વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર થાય છે અને ગ્રાહકો આ વિશિષ્ટ ઓફરોનો લાભ લેવા નજીકના ડિલરનો સંપર્ક કરી શકશે.

મહેરબાની કરીને સોશિયલ મીડિયા અપડેટ માટે નીચેના હેશટેગ્સ/હેન્ડલ્સનો ઉપયોગ કરો:

#Mahindra4CovidCaretakers
@MahindraRise
@Mahindra_Auto

મહિન્દ્રા વિશે

20.7 અબજ ડોલરનું મહિન્દ્રા ગ્રૂપ વિવિધ કંપનીઓનું જૂથ છે, જે લોકોને નવીન મોબાલિટી સોલ્યુશન્સ મારફતે સક્ષમ બનાવે છે, ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ લાવે છે, શહેરી જીવનની ગુણવત્તા વધારે છે, નવા વ્યવસાયોને પોષણ આપે છે અને વિવિધ સમુદાયોને પ્રોત્સાહન આપે છે. તે ભારતમાં યુટિલિટી વ્હીકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને વેકેશન ઓનરશિપમાં ટોચનું સ્થાન ધરાવે છે તથા વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરની સૌથી મોટી કંપની છે. આ એગ્રીબિઝનેસ, એરોસ્પેસ, કમર્શિયલ વ્હીકલ્સ, કમ્પોનેન્ટ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, રિન્યુએબલ એનર્જી, સ્પીડબોટ્સ અને સ્ટીલ સહિત વિવિધ વ્યવસાયોમાં મજબૂત હાજરી ધરાવે છે. ભારતમાં હેડક્વાર્ટર ધરાવતું મહિન્દ્રા ગ્રૂપ 100 દેશોમાં 240,000થી વધારે લોકોને રોજગારી આપી છે.

વધારે જાણકારી મેળવવા માટે વેબસાઇટ જુઓ: www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise

Media contact information

Mohan Nair
Vice President (Communications)
Mahindra & Mahindra Ltd.
Landline – + 91 22 28468510
Email – nair.mohan@mahindra.com